

M.A. Semester - 3 (CBCS) Examination

Oct/Nov. - 2018

BEHAVIOUR MODIFICATION (ELECTIVE - 3/INTER DES)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ વર્તન ફેરફાર એટલે શું? વર્તન ફેરફારનાં પાયાનાં શિક્ષણ સિદ્ધાંતની ભૂમિકા સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ અસીલની સામેલગીરી વધારવાની પદ્ધતિ વર્ણવો.
- પ્રશ્ન-૨ બેકની બોધનાત્મક ચિકિત્સા પદ્ધતિનું મોડેલ વર્ણવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ ક્રિયાત્મક અભિસંધાન પ્રયુક્તિની સમજૂતી આપો.
- પ્રશ્ન-૩ દ્રઢતા નિશ્ચયાત્મકતા માટેની તાલીમની પ્રક્રિયા સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ જકોબ્સનની રીલેક્શસન પદ્ધતિ વર્ણવો.
- પ્રશ્ન-૪ કમબધ્ધ અસંવેદનીકરણની પ્રક્રિયા વર્તન ફેરફારમાં કેવી રીતે ઉપયોગી છે, સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ ક્રિયાત્મક અભિસંધાનની તરકીબ એટલે શું? તેનાં લક્ષણો અને કેટલાક પાયાનાં પ્રતિમાન પ્રબલનો સમજાવો.
- પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)
(૧) વર્તન ઉપચારનો ચિકિત્સાત્મક ઉપયોગ.
(૨) બાલ્યાવસ્થાની વિકૃતિ.
(૩) બોધનાત્મક વર્તન ફેરફાર એટલે શું?
(૪) યોગની વિશ્રામ પ્રયુક્તિ તરીકે ટૂંકમાં સમજૂતી આપો.

ENGLISH VERSION

- Que-1 What is behaviour modification? Explain the role of learning theory. Foundation of Behaviour modification. (14)
OR
- Que-1 Explain the theory of enhancing client's involvement.
- Que-2 Explain the Back's Cognitive therapy model. (14)
OR
- Que-2 Explain the operant conditioning technique.
- Que-3 Explain the procedure of assertive training. (14)
OR
- Que-3 Explain Jacobson's relaxation technique.
- Que-4 Explain how systematic desensitization procedure can be useful for behaviour modification. (14)
OR
- Que-4 What is operant conditioning technique? Explain its characters and some basic paradigm.
- Que-5 Write short not any two. (14)
(1) Clinical application of behaviour theory.
(2) Child hood disorder.
(3) What is cognitive behaviour modification?
(4) Explain the short yoga as relaxation technique.
